



ચોમાસુ વરિયાળીની પૈશાનિક ખેતી પદ્ધતિ

ડૉ. મનીષકુમાર વી. પટેલ - ડૉ. રમેશભાઈ એ. પટેલ

: પ્રકાશક :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

ગાણપત ચુનિવર્સિટી

મહેસાણા-ગોક્રારીયા હાઇપે, ગાણપત વિધાનગર-૩૮૪૦૧૨
તા. ગુ. મહેસાણા. ફોન : ૦૨૭૬૨-૨૮૯૯૮૮, ૯૭૮૦૩૩૪૭૧

E-mail. kvkmehsana@yahoo.co.in - kvkmehsana@gmail.com
Website : www.kvkmehsana.org

વરियाणीના બીજનો ઉપયોગ ભોજન પછી મુખવાસ તરીકી ખૂબ જ પ્રચલિત છે. તદ્દિપરાંત દાણાનો ઉપયોગ શરબત અને અથાળા બનાવટમાં થાય છે. વરિયાણી બીજમાં રહેલ ઉહનશીલ સુગંધિત તેલ (૧.૫ થી ૩.૮ ટકા) બેડ, કેક, દવાઓ, ઠંડા પીણાં, સુગંધિત સાખુ વિગેરે બનાવટમાં વપરાય છે. વરિયાણીના લીલા પાંડડાનો ઉપયોગ શાકભાજી તરીકી પણ કરી શકાય છે. સુગંધિત તેલ કાઢી લીધા બાદ દાણાનો ઉપયોગ પશુદાણ તરીકી થાય છે. વરિયાણીના સ્કૂકા રાડાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં બળતણ તરીકી પણ થાય છે. ભારતમાં વરિયાણીનું વાવેતર આશરે ૪૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતમાં વરિયાણીનું વાવેતર આશરે ૩૬,૦૦૦ હેક્ટર વિસ્તારમાં થાય છે અને તેમાંથી આશરે ૫૭,૦૦૦ ટન જેટલી વરિયાણી પેદા થાય છે. દેશ તથા વિદેશોમાં ઉત્પાદન અને ઉત્પાદકતા (૧૫૭૮ કિગ્રા/હે) માટે ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાત દેશની કુલ વરિયાણીનું ૮૬ ટકા ઉત્પાદન કરે છે.

જમીન અને આબોહ્વા : -

વરિયાણીના પાક માટે ગોરાડુ, મધ્યમ કાળી કે ભાઠાની સારી નિતારશક્તિ ધરાવતી સેન્ટ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય તેવી જમીન વધુ માફક આવે છે. કાળી જમીનમાં પણ યોગ્ય રીતે પાણીનું નિયમન કરવામાં આવે તો વરિયાણીનો પાક સફળતા પૂર્વક લઈ શકાય. ક્ષારિય કે ખરાબ નિતારશક્તિવાળી જમીન વરિયાણીના પાક માટે અનુકૂળ નથી. ઠંડી ઝતુનો પાક હોવાથી સ્કુ અને ઠંડુ હવામાન આ પાકને વધારે અનુકૂળ છે. લાંબી અને ઠંડી રાત્રિ કુલની શરૂઆતથી બીજના વિકાસ સુધી વધુ ફાયદાકારક છે. કાપણી સમયે પાકને ગરમ હવામાન અને પુરતા સ્વીકારક અનુકૂળ નથી.

સુધારેલી જાતો : -

વરિયાણીની સુધારેલી જાતો ગુજરાત વરિયાણી-૨ અને ગુજરાત વરિયાણી-૧૨ના પ્રમાણિત બીજનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ.

ધરુવાડિયાની તૈયારી : -

ખરીફ અતુ માટે : -

ધરુવાડિયા માટે ઊંચી, સારા નિતારવાળી, નિંદામણ મુક્ત તથા પિયત માટે પાણીની સગવડ નજીકમાં હોય તેવી જમીન પસંદ કરવી. પસંદ કરેલ જમીનમાં ‘રાખીંગ’ કરવું એટલે કે ગૌણ ઘેત પેદાશ જેવીકી બાજરી, વરિયાણી, રાયડો વગેરેના રાડાનો ધરુવાડિયાની જમીન પર અડધો કુટ જેટલો થર કરીને સળગાવવું. રાખીંગ કરવાથી જમીનમાં રહેલ નિંદામણના બીજ, કૃભિ તેમજ અન્ય જમીન જન્ય કુગ તથા જીવાણુઓનો નાશ થાય તેમજ જમીનમાં રાખ ઉમેરાવાથી જમીન પોચી બને છે ને ધરુના ઉગાવામાં મદદ દૃપ થાય છે.

ધરુવાડિયાના ક્યારા આશરે ઉ મી. x ૧ મી. ના માપના બનાવવા. સામાન્ય રીતે એક હેક્ટર (૧૦૦ ગુંડા) વિસ્તારની ફેરોપણી માટે ૧૦૦ ચો.મી. (૧ ગુંડો) જમીનમાં ધરુવાડિયું બનાવવું અને તે માટે ૧.૫૦૦ કિગ્રા બીજનો ઉપયોગ કરવો. બીજને વાવતાં પહેલાં ૨૪ કલાક સુધી પાણીમાં પલાળી, છાંચામાં સુકવી બીજને સેરેસાને થાયરમનેવી દવાનો પ્રતિ કિગ્રા દીઠ ત્રણ ગ્રામ પ્રમાણે પટ આપી જૂન માસના પ્રથમ પખવાડિયામાં પૂંખીને વાવળી કરવી ત્યાર બાદ બીજને પંજેઠીની મદદથી જમીન સાથે ભેણવી દઈને હળવું પિયત આપવું. વાવળી બાદ ધરુવાડિયાને કરાંઠીથી ઢાંકી દેવાથી ઉગાવો જડપી અને સારો થાય છે. પ્રથમ પિયત બાદ ત્રણ થી ચાર દિવસે બીજુ હળવું પિયત આપવું અને તે પછી એકાંતરે સાંજના સમયે પિયત આપવું. બપોરના સમયે પિયત આપવાથી ધરુને મૂળભાઈનો (કહોવારો) રોગ આવવાની શક્યતા છે. વાવળી બાદ ૪૦ થી ૪૫ દિવસે ધરુ પાટલે પેડ ત્યારે રોપણી લાયક થઈ જય છે. તે સમયે ધરુની ઊંચાઈ ૨૫-૩૦ સે.મી. જેટલી હોય છે. ફેરોપણીના આગણના દિવસે ધરુવાડિયામાં હળવું પિયત આપવું. જેથી સહેલાઈથી ધડ તંતુમૂળ સહિત ઉપાડી શકાય.

પ્રાથમિક ખેડ : -

જમીનને બે થી ત્રણ વાર હળ અને કરબ વડે આડી-ઉભી ખેડી ડેકાં ભાગી ભરભરી બનાવવી. ખેડ કરતી વખતે ભલામણ મુજબ જમીનમાં હેક્ટરે ૨૫ ગાડા સારુ કહોવાયેલુછાણિયુભાતર નાખી ખેતરમાં બરાબર ભેણવી દેવું.

રોપણી અંતર તથા સમય : -

ચોમાસુ પાકની રોપણી બે લાઈન વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી. નું અંતર રાખી ૧૫ મી ઓગાણની આસપાસ જમીનમાં પુરતો બેજ હોય ત્યારે સાંજના સમયે કરવી હિતાવહ છે. ચોમાસુ રોપણી સમયે વરસાદ ન હોય તો રોપણી બાદ તુરતજ પિયત આપવું.

ખાતર વ્યવસ્થા : -

ચોમાસુ ફેર રોપણી માટે ભલામણ કરેલ ખાતરનો જથ્થો ૧૦૦+૬૦ કિલો ના.ફો. પ્રતિ હેક્ટર છે.

અ.ન. ખાતરની

રાસાયણિક ખાતર રાસાયણિક ખાતર

જરૂરીયાત

(કિ.ગ્રા./હે) આપવાનો સમય અને પદ્ધતિ

ડી.એ.પી. યુરિયા

૧ પાયાનું ખાતર

૧૩૦ ૩૭ ફેરોપણી અગાઉ ચાસમાં ઓરીને

(૪૦+૬૦ કિગ્રા.ના.ફો./હે)

આપવું

૨ પુર્તિ ખાતર (૩૦ કિગ્રાના./હે.)	-	૬૫ પાક ૩૦ દિવસનો થાય ત્યારે જનદામણા કર્યા બાદ થડ થી ચારથી પાંચ સે.મી. દૂર થડની ફરતે કુંડાળામાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.
(૩૦ કિગ્રાના./હે.)	-	૬૫ પાક ૬૦ દિવસનો થાય ત્યારે જનદામણા કર્યા બાદ થડ થી ચારથી પાંચ સે.મી. દૂર થડની ફરતે કુંડાળામાં પુરતો ભેજ હોય ત્યારે આપવું.

પિયત : -

ચોમાસુ વરિયાળી લાંબા ગાળાનો પાક હોઈ પિયતમાં કાળજી રાખવી જરૂરી છે. વરસાદ બંધ થયા પછી ૮ થી ૧૦ પિયત પૂરતા થઈ પડે છે. જમીનના પ્રત અને હવામાન મુજબ પિયત ૧૫ થી ૨૦ દિવસના અંતરે આપવું. વરિયાળીના પાકમાં કાળિયો (ચરમી) અને સાકરીયો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે પાણીનું નિયમન ખૂબ જરૂરી છે. તેથી પાણીની અછત વત્તાય તો જ હળવું પિયત આપવું. પાકની કટોકટી અવસ્થાઓ જેવી કે કુલ આવવાનો ગાળો તથા દાઢા વિકાસની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.

આંતરખેડ અને નિંદામણા : -

ફેરોપણી પછી ૭૫ દિવસ સુધી જરૂરીયાત મુજબ આંતરખેડ કરવી. પ્રથમ આંતરખેડ ૨૫ દિવસે કરવી અને ત્યારબાદ નિંદામણનો ઉપક્રમ ધ્યાનમાં રાખી ૨૦ થી ૨૫ દિવસના ગાળો આંતર ખેડ કરવી. નિંદામણના કારણે વરિયાળીના પાકમાં ૧૦-૪૨ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જેથી પાકને નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે.

પાળા ચઠાવવા : -

ચોમાસુ પાકની સારી વૃદ્ધિ તથા ચક્કરોનું પ્રમાણ વધારે હોવાથી છોડને ટળી પડતો અટકાવવા માટે પાકની ફેરોપણીના ૭૫ દિવસે છોડની ફરતે પાવડાની મદદથી માટી ચઠાવવી. વરિયાળીના નીચેના પીળા પાન તોડી નાખવા.

પાક સંરક્ષણા : -

(અ) રોગ

(૧) રેમ્યુલેરીયા ફુગથી થતી ચરમી

લક્ષણો : -

આ ફુગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચક્કરની દાંડી જેવા કુમળા ભાગમાં

તथा દાણા ઉપર છીકળી રંગના નાના આકારના ઢુપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચક્કરની પાંખડીઓ વગેરે ભાગો સફેદ અથવા રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે.

(૨) અલ્ટરનેરીયા કુગથી થતી ચરમી

લક્ષણો : -

રોગની શક્તિઆત થતાં કુલ અને કુમળા પાન સુકાઈ જઈ ખરી પડે છે. અસર પામેલા છોડના પુષ્પ ગુચ્છમાં દાણા બેસતા નથી. આ રોગ કુલ અને દાણા ઉપર સીધી અસર કરે છે. રેમ્યુલેરીયા કુગથી થતા સુકારાના રોગ કરતાં આ રોગ વધુ પ્રમાણમાં નુકશાન કરે છે.

નિયંત્રણા : -

- (૧) વાવળી માટે રોગમુક્ત બીજની પસંદગી કરવી.
- (૨) બિયારણને વાવતાં પહેલાં કેટાન અથવા થાયરમ દવાનો બે થી ત્રણ ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને જ વાવવા.
- (૩) આ રોગને ફેલાતો અટકાવવા માટે રોગ દેખાય કે તરત જ મેન્કોઝેબ (૨૭ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) સાથે ૧૦ મીલી. ટીપોલ અથવા તૈલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં બેળવી તેના ૧૫ ટિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા જરૂરી છે.
- (૪) વાદળાથા વાતાવરણમાં અથવા રોગનો ઉપદ્રવ જોવા મળે તો પિયત આપવું નહીં.

(૩) મુળનો કહોવારો (સડો)

લક્ષણો : -

જમીન જન્ય કુગથી થતો આ રોગ ફેર રોપળી પછી ૧૫ થી ૨૦ ટિવસ પછી છોડના મુળને અસર કરે છે. જેને કારણે છોડ ઉપરથી પીળો પડવા માಡે છે. પાણીની ખેંચ હોય તેમ છોડ લંઘાતો જોવા મળે છે. સમય જતાં અસરગ્રસ્ત છોડ જમીન ઉપર ઢળી પડે છે. ઢળી પડેલા છોડને ઉપાડીને જોતાં મુખ્ય મૂળ સહિત બધા જ મૂળ ભૂખરા રંગના, રેખાવાળા તાંત્રણા જોવા થઈ ગયેલા જોવા મળે છે. જમીનના ઉંચા ઉઝણતામાને આ રોગ થી ધાણું નુકશાન થાય છે.

નિયંત્રણા : -

- (૧) ખાસ કરીને જમીનનું ઉઝણતામાન ઉંચુ હોય ત્યારે રોગથી વધારે નુકશાન થતું હોવાથી પાકને સમયસર અને માફકસરનું જ પાણી આપવું.

- (૨) ફેરારોપળી કરતાં પહેલાં વરિયાળીના ધરુને તાંબાયુક્ત કુગનાશક દવાના (૪૦ ગ્રામ/૧૦ લીટર) દ્રાવણમાં બોળીને વાવવા.
- (૩) છોડ પાણીના સીધા સંપર્કમાં લાંબો સમય ન રહે તે માટે ફેર રોપળી બાંદ ૬૦ થી ૭૫ દિવસે છોડની આસપાસ માટી ચઢાવવી.
- (૪) આ રોગ વ્યાપક પ્રમાણમાં જેવા મળે તો બજરમાં મળતી તાંબાયુક્ત કુગનાશક દવાનું (૪૦ ગ્રામ/૧૦ લીટર) દ્રાવણ બનાવી છોડના થડની આસપાસ રેડવું.
- (૫) ધરુનો કહોવારો

લક્ષણો : -

આ રોગ ધરુવાડિયામાં છોડનો ઉછેર દરમ્યાન જેવા મળે છે. ધરુવાડિયાના કહોવારામાં છોડ ધીરે ધીરે સુકાવા લાગે છે અને વાંકો વળી પીળાશ પડતો દેખાય છે અને મૂળનો ભાગ કહોવાઈ જાય છે.

નિયંત્રણા : -

તાંબાયુક્ત દવાઓ જેવી કે રીડોમીલ એમ-એડ ૧૫ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી ધરુવાડિયામાં સરખી રીતે રેડવું.

(૫) ભૂકીછારો

લક્ષણો : -

પવન દ્વારા ફેલાતો આ રોગ છોડના કુમળા ભાગો પર સફેદ પાવડર છાંટયો હોય તેવા રૂપમાં દેખાય છે. સમય જતાં રોગની તીવ્રતા વરિયાળીના છોડના પાન, ડાળી, ચક્કરની પાંખડીયો વગેરે ઉપર કુગની સફેદ વૃદ્ધિ દેખાય છે. જે કુગના બીજાણુંઓ હોય છે અને તે પવન દ્વારા વાતાવરણમાં પ્રસરે છે.

નિયંત્રણા : -

- (૧) રોગની શરૂઆત થાયું તરત જ તુંદું ૩૦૦ મેશ ગંધકની બારીક ભૂકી ૨૫ કિગ્રા/હેક્ટર પ્રમાણે છાંટવી.
- (૨) દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં લેળવી છાંટકાવકરવો.
- (૩) ડીનોકેપ ૧૦ મીલી અથવા ટ્રોટીડીમાર્ફ ૫ મીલી પ્રતિ ૧૦ લીટરમાં પાણી લેળવી છાંટવાથી રોગ ફેલાતો અટકી જાય છે.

(૬) સાકરીયો (મધિયો)

લક્ષણો : -

સાકરીયો એ કોઈ રોગ નથી પરતું છોડની દેહધાર્મિક વિકૃતિ છે. કુલમાંથી મધ્ય જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે.

આવી વિકૃતિ ખૂબજ ફળકુપ જમીનમાં છાશવારે જોવા મળે છે. વધારે પડતા હંડા અને ભેજવાળા વાતાવરણમાં આ પ્રશ્ન સામાન્ય છે. કુલમાંથી નીકળેલા મધુ જોવા પ્રવાહી ઉપર મોલ અને બહારની કુગનો વિકાસ શરૂ થાય છે. છોડ કાળો થઈ જાય છે. આના કારણે દાણાના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર વિપરીત અસર પેડે છે.

નિયંત્રણ :- વધુ પડતા પિયત અને નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ટાળવો.

(૭) ફાયલોડી (પર્ણગુરુચ)

વરિયાળીના પાકમાં તાજેતર વર્ષોમાં પર્ણગુરુચનો રોગ જોવા મળેલ છે. જેને માટે માઈકોએલાઝમાં નામનો રોગપ્રેક જવાબદાર છે. જે જમીનમાં અગાઉ તલનું વાવેતર કરેલ હોય તેવા ઐતરમાં ઉપક્રમ વધારે જોવા મળે છે. આ રોગપ્રેકનો ફેલાવો હોપર નામની જીવાત કરે છે. રોગની અસર શરૂઆતથી જણાય છે. છોડના નીચેના પાન પીળાં પડવા લાગે છે અને છોડ ઢીંગણો રહે છે. છોડ ઉપર ચક્કર બેસતા નથી. પરંતુ કુલમાંથી સીધો વાનસ્પતિક વિકાસ થાય છે અને દાણા આવતા નથી.

નિયંત્રણ :-

- (૧) શક્ય હોય ત્યાં સુધી તલ પછી વરિયાળી પાક વાવવાનું ટાળવું.
- (૨) ઐતરમાં એકલ દોકલ રોગિઓ છોડ જણાય તો ઉપાડીને તેનો નાશ કરવો.
- (૩) રોગનો ફેલાવો કરનાર કીટકનું રાસાયણિક જંતુનાશકો દ્વારા નિયંત્રણ કરવું.

(બ) જીવાત

(૧) મોલો મશી

મોલોમશીના અસરકારક અને પોખણક્ષમ નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૧૦ મીલી મિથાઈલ-ઓ-ડિમેટોન અથવા ૧૦ મીલી ડાયમીથોએટ અથવા ઈમીડાકલોપ્રિડ ઇ મીલી/થાયોમેથોક્ઝામ ૩-૪ ગ્રામ/એસીટામેપ્રિડ ૩ ગ્રામ પૈકી કોઈ એક શોષેક પ્રકારની જંતુનાશક દવા બેણવી છંટકાવ કરવો જોઈએ.

(૨) દાણાની માખી (સીડમીંક)

આ જીવાત વરિયાળી અને દાણા તૈયાર થયેલ બીજમાં જોવા મળે છે. આ જીવાત વરિયાળી તેમજ દાણાના બીજમાં સંગ્રહ દરમ્યાન સાફ્ટે મ્બ્યર-ઓક્ટોબર માસમાં નુકશાન કરતી હોય છે. પરિણામે સંગ્રહ કરેલ દાણાની ગુણવત્તા અને વજન ઘટે છે.

નિયંત્રણ :-

આ જીવાતના નિયંત્રણ માટે ઉભા પાકમાં ૨૦ મીલી. પ્રોફેનોફોસ-૨૦ મીલી. અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન અથવા મોનોકોટોફોસ ૧૦ મીલી. અથવા ડી.ડી.વી.પી.પ. મી.લી. દવાનો ૧૦ લીટર પાણીમાં બેળવી છંટકાવ કુલ આવ્યા પછી અને ત્યારબાદ ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ કરવો.

(3) લાલ કથીરી

લાલ કથીરીના નિયંત્રણના માટે ડાયકોફોલ (૧૫ મીલી./૧૦ લીટર પાણીમાં) બેળવી છાંટવાની ભલામણ થયેલ છે.

કાપણી :-

ચોમાસુ પાક આશરે ૨૧૫ દિવસે તૈયાર થાય છે. દાણાની ગુણવત્તાનો આધાર પરિપક્વતા અને કાપણીના સમય ઉપર અવલંબ છે. આથી દેહ ધાર્મિક પરી પક્વતા એટલે કે જ્યારે દાણાની ઉપરની નસો લીલી હોય અને દાણો ભરાવદાર થાય ત્યારે કાપણી કરવી હિતાવહ છે. વરિયાળીની ગુણવત્તાનો મુખ્ય આધાર લીલો રંગ હોવાથી તેની જણવણી માટે જેમ જેમ ચક્કરો પાકતાં જય તેમ તેમ ઉતારી તેને છાયામાં હવાની અવરજનર હોય તેવી જગ્યાએ સ્કૂવવા. ચક્કરો વારંવાર ફેરવાતાં રહેવું. કોઈપણ સંભેગોમાં ચક્કરોનો ઢગલો કરવો નહિ. પૂરૈપૂરા સ્કૂવેલા ચક્કરોને જુદા તારવી પાકા સ્વચ્છ ખળામાં લાકડા વડે ઝૂડીને દાણા છુટા પાડવા તથા ઉપણીને વરિયાળી સાફ કરવી. વરિયાળીના દાણામાં વધુ બેજ ન રહે તે માટે ફરી છાયામાં સ્કૂવવી. ઝૂડૂતો અપરિપક્વ ચક્કરો કાપતા હોય છે. જેમાં રેસાનું પ્રમાણ ઓછુ તથા ખાંડનું પ્રમાણ વધારે હોય છે. જે મુખવાસ માટે વધુ પ્રચલિત છે. પરંતુ આનાથી ઉત્પાદન ઓછુ અને વેચાણ ભાવ વધારે મળે છે તથા અપરિપક્વતાને કારણે બિયારણ માટે વાપરવા હિતાવહ નથી. બીજ માટે હંમેશા પરિપક્વ ચક્કરોની જ વીજણી કરવી.

ઉત્પાદન : - ચોમાસુ વરિયાળીનું ઉત્પાદન હેક્ટરે ૨૦૦૦ થી ૨૫૦૦ કિ.ગ્રા. મળે છે.

: વધુ માહિતી માટે :

નામ	વિષય	મોબાઇલનંબર
ડૉ. મનીષભાઈ વી. પટેલ	બાગાયત.	૯૯૨૫૨૭૬૭૭૧૪
શ્રી ભરતભાઈ કે. પટેલ	પાક ઉત્પાદન.	૯૮૭૬૮૨૦૮૧૮
ડૉ. રમેશભાઈ એ. પટેલ	પાક સંરક્ષણ.	૯૪૨૭૬૬૨૮૦૫
ડૉ. શરદ એમ. સોની	પશુપાલન	૯૨૨૮૩૩૨૬૮૧
શ્રી મુકેશભાઈ આર. પટેલ	વિસ્તરણ શિક્ષણ.	૮૫૧૧૨૨૧૧૫૮
કુ. રીનાબેન આર. પટેલ	ગૃહવિજ્ઞાન.	૯૪૨૭૬૫૦૩૮૨